

78 78 5 91 0 92 પર GK લખી વોટ્સેપ પર સેન્ડ કરો.

Current affairs 3 (2) સામાન્ય જ્ઞાન 21-2-2017

Page-1

રાષ્ટ્રીય

૧) એરપોર્ટ પર મુસાફરોને સેવા આપવા માટે પુણે એરપોર્ટ દેશમાં પ્રથમ અને વિશ્વમાં 29 માં નંબરનું સ્થાન ધરાવે છે.

૨) 20 ફેબ્રુઆરી 2009 ના રોજ કોલકાતા હાઈકોર્ટના જસ્ટીસ સેન વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપસર મહાભિયોગ લાદવામાં આવેલ.

૩) આગામી 22 ફેબ્રુઆરી 2017 ના રોજ મુંબઈ ખાતે એમ્બ્યુમેન્ટ પાર્ક ઈન્ડસ્ટ્રીઝનો 17 મો એક્સ્પો આયોજિત થશે.

૪) દક્ષિણ ભારતના તિરુવનંતમપુરમમાં 24 ફેબ્રુઆરી 2017 થી લોકકલા ઉત્સવ શરુ થશે.

૫) 25 ફેબ્રુઆરી 2017 ના રોજ મુંબઈ ખાતે એલ.આઈ.સી. ગેટ-વે ફેસ્ટીવલની શરુઆત થશે.

૬) હાલ ભારતનું કેરલ રાજ્ય ઘટતી જતી સ્થિતિએ નેચરલ રબ્બરનું ઉત્પાદન કરવામાં અન્ય રાજ્યો કરતા અગ્રેસર છે.

૭) નાગાલેંડમાં સરકાર અને દેખાવો વચ્ચેની સમસ્યાને હળવી કરવા માટે હાલ ત્યાના મુખ્યમંત્રી ટી.આર.જેલીયાંગ રાજીનામું આપશે.

૮) ભારત દેશના પૂર્વ ચીફ જસ્ટીસ અત્તમસ કબીરનું 68 વર્ષની વયે કોલકાતા ખાતે અવસાન થયેલ છે.

૯) 29 મી સપ્ટેમ્બર 2012 ના રોજ અત્તમસ કબીર દેશના 39 માં ચીફ જસ્ટીસ તરીકે નિયુક્ત થયા હતા.

૧૦) આગામી મેં માસથી પ્રોવિડન્ટ ફંડની રકમ મેળવવા ઓનલાઈન અરજી કર્યા બાદ ત્રણ કલાકમાં એ નાણા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે.

ગુજરાત

૧૧) ગુજરાતનું અમદાવાદ એરપોર્ટ મુસાફરોને સુવિધા આપવાના મામલે દેશનું ચોથા નંબરનું તથા વિશ્વમાં 38 માં નંબરનું સ્થાન પામેલ છે.

21-2-2017

આંતરરાષ્ટ્રીય

૧૨) વિશ્વમાં સૌથી વધારે સ્ટીલનું ઉત્પાદન ચીન દેશ કરે છે, જ્યારે ભારત સ્ટીલના ઉત્પાદનમાં ત્રીજા નંબરે આવતો દેશ છે.

૧૩) 20 ફેબ્રુઆરી 2017 ના રોજ દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય ટેલીકોમ પ્રદર્શન યોજાયેલ.

રમત જગત

૧૪) હાલમાં આઈ.પી.એલ.ની ટીમ રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સે મહેન્દ્રસિંહ ઘોનીને સુકાની પદેથી હટાવી સ્ટિવ સ્મિથને તેમનું સ્થાન સોંપેલ છે.

૧૫) આઈ.સી.સી વિમેન્સ વર્લ્ડકપ ક્વાલીફાયરની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને સાત વિકેટે હરાવેલ છે.

૧૬) હાલમાં ચેક રિપબ્લિકના પ્લીસકોવાએ ટુર્નામેન્ટની ફાઈનલમાં કેરોલીનાને પરાજય આપી ચાલુ વર્ષે બીજું ટાઈટલ પોતાના નામે કરેલ છે.

૧૭) આગામી ક્રિકેટ પ્લેયર્સની હરાજી થવાની તેમાં કુલ સાત પ્લેયર્સની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા છે, તેમાં માત્ર ભારતના એક ખેલાડી ઈશાંત શર્માનો સમાવેશ થાય છે.

અન્ય

૧૮) વાયુ પ્રદુષણના કારણે દેશના બે શહેરો પટના અને નવી દિલ્હી સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

૧૯) 20 ફેબ્રુઆરી 1987 માં મિઝોરમ રાજ્યને દેશનું 23 મુ રાજ્ય બનાવવામાં આવ્યું હતું.

૨૦) ભારતના સાક્ષરતાના મામલે મિઝોરમ રાજ્ય દેશનું બીજા નંબરનું રાજ્ય છે, જ્યારે કેરલ પ્રથમ નંબર પર આવે છે.

21-2-2017

સમીક્ષા 205 (1) તારીખ 21/2/2017

ભારતીય સૈન્યમાં આઈ.એન.એસ.તારિણી સામેલ કરવામાં આવી...

- ૧) 18 ફેબ્રુઆરી 2017 ના રોજ સમુદ્રી હોડી તારિણી નેવીમાં સામેલ કરવામાં આવેલ છે.
- ૨) આ પહેલા નેવીએ પોતાના હિસ્સામાં એક જહાજને સામેલ કર્યું હતું.
- ૩) આ તારિણી નામના જહાજ પર આગામી ઓગસ્ટ માસમાં પ્રથમ વાર પુરા વિશ્વના ભ્રમણ માટે એક ટીમ નીકળશે.
- ૪) આ ટીમમાં નેવીના મહિલા સભ્યો ભાગ લેશે, અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આ પ્રયાસ કરવામાં આવશે.
- ૫) સામુદ્રિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે પણ છ મહિલાઓના જૂથને પસંદ કરવામાં આવેલ છે.
- ૬) સમગ્ર ટીમનું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર વર્તિકા જોશી સંભાળશે.
- ૭) આ ટીમ સમુદ્રમાં 10 હજાર નોટીકલ માઈલનો પ્રવાસ ખેડશે. તેઓના ઉત્સાહને વધારવા નેવી પ્રમુખ એડમિરલ સુનીલ લાંબા પણ હાજર રહ્યા હતા.

– પરેશ ચાવડા

21-2-2017

રોજે- રોજ આપના ફોનમાં જી.કે, કન્ટ અફેર્સ મેળવવા નીચેની લીંક પરથી એપ ડાઉનલોડ કરો.

<https://play.google.com/store/apps/details?id=com.edusafar>

11 થી 12 ફેબ્રુઆરી કન્ટ અફેર્સનો ગુજરાતી વિડીયો નીચેની લિંક પરથી જુઓ.

https://www.youtube.com/watch?v=elz6_59HIZs

ગણિત, ઘોરણ 10 નું પ્રકરણ 9 ના મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન સોલ્યુશન ગુજરાતી વિડીયો માટે .

<https://www.youtube.com/watch?v=p1BFnDulHPA&t=38s>

ઈસરોની સિદ્ધિનો ગુજરાતી વિડીયો નીચેની લિંક પરથી જુઓ

<https://www.youtube.com/watch?v=vjf8ZzFXBVo&t=108s>

બેસ્ટ જીકે વિડીયો માટે નીચેની લીંક ઓપન કરો.

https://www.youtube.com/channel/UCfDAM9P2RF_ynz8B_j5enC

મિત્રો, એજ્યુસફર દ્વારા **GK** ના વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે આ માટે **YouTube** પર જઈ, **EduSafar** લખી સર્ચ કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી **GK** વિડીયો ના નવા અપડેટ્સ મેઈલ પર મળતા રહેશે.